

COVID-19 vaccine and immunity: A doctor explains the connection



Everyone wants to strengthen their immune system so that they can ward off diseases, or fight them, effectively. In the ongoing pandemic, the one question that many people have asked is about the efficacy of the COVID-19 vaccine, and if one actually needs it. Dr Sandeep Patil, chief intensivist at Fortis Hospital Kalyan, explains the process of vaccine-induced immunity and says that vaccination has become a "critical addition" to our defenses against COVID-19.

This much is certain. But our ability to achieve vaccination-induced herd immunity is still unknown. That shouldn't stop us from trying. It also shouldn't stop us from trying. The stop is indianexpress.com." If COVID-19 is a raging forest fire, then vaccines are the firefighters trying to quell it. We have to continue with the preventive measures — social distancing, mask wearing, hand hygiene, and rapid testing. Dr Patil further states that according to the World Health Organization (WHO) estimates, 65 to 70 per cent of a given population must be vaccinated to halt the spread of disease. "Once that threshold is crossed, the COVID-19 virus will have too few human hosts to choose from, driving down transmission rates dramatically. The process of getting there is simple theory, but laborious and time-consuming in practice." Vaccine safety and immunity

The doctor points out that certain concerns about vaccine safety relate to how vaccines interact with the immune system, or even how the immune system functions in different situations. "For example, natural infection versus immunisation. While it is fair to consider these concerns, it is important to understand them in the context of how the immune system morks. It is true that natural infection causes better immunity than vaccines. The difference, however, between vaccination and natural infection is the price paid

Woo second-generation **Indian-Americans**

Indian-Americans
Undeterred by weather or wallet, they do their bithold up placards, shout slogans, lobby lawmakers, and, involuntarily, prefix Your' to references of Indian prime ministers. They still do their bit, but not as often as they did donce. Their fulldren' Even less. "The diaspora that the Indian government has come to know is not static," says a new report based on a 2020 survey of Indian-Americans Indian-Americans Londiandescent Americans bear and raised in the United States (US) "exhibit different sensibilities both with respect to politics in India as well as politics colored to the profit (Loss) for the perior US-focused than their parents' generation". This aspect of the good than their parents' generation. "They are also "less engaged with India and more used to the period they are they are the period than a Mericans view India? Results from the 2020 Indian Americans view India. and Sumitra Badrinathan merits more attention. Second-generation Indian-Americans

Printed & Published by Mayur C Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd Printed at: Mahadev Offset, H-47 Ravi Estate, Rustam Mill Compound, Dudheshwar, Ahmedbada-4, Published from 201-2, Nandan Com. Opp. Mithakhal Rly Crossing, Mithakhali, Alt-6 Edi.. Mayur Bhatt

Date:13/02/2021 Place:Ahmedabad

GLOBE TEXTILES (INDIA) LIMITED

(CIN: L65910GJ1995PLC027673)
(Regd. Office:Plot No. 38 to 41, Ahmedabad Apparel Park, GIDC Khokhra, Ahmedabad, Gujarat - 380008)
E-mail id: cs@globetextiles.net | website: www.globetextiles.net Contact No: 0091-79-22931881 to 1885 Extract of Un-Audited standalone Financial Results for the Quarter ended 31st December, 2020

	(Rs. In Lakhs) Except EPS and Face Value of Share		
	Quarte	Nine Month Ended	
Particulars	31-12-2020	31-12-2019	31-12-2020
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total income from operations (net)	9832.31	7524.80	18279.90
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	176.35	(84.48)	(53.25)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	176.35	(84.48)	(53.25)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	176.35	(84.48)	(53.25)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	175.70	(85.53)	(55.19)
Equity Share Capital	1007.61	1007.61	1007.61
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)			
Earnings Per Share (of `Rs.10/- each)(for continuing and discontinued operations)			
Basic:	1.74	(0.85)	(0.55)
Diluted:	1.74	(0.85)	(0.55)

to be 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing bilgations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the the website of the Company www.globetextiles.engl and on the website of SEE titd. (www.nscindic.com/services) and the company of the profit of the Company of the Comp

The impact on the private hosts used to the property of the pr

For, GLOBETEXTILES (INDIA) LIMITED

Sd/-Bhavik Suryakant Parikh (Managing Director) (DIN: 00038223)

A resilient future for Uttarakhand

Days after a glacier burst in the Chamoli district of Uttarakhand caused flash floods, the scientific community is still struggling to understand what triggered the disaster. At the time of writing this article, the death toll was 34 with more than 170 people missing. The floods have also caused heavy damage to public and private infrastructure, including the NTPC of the result of the Rishiganga mini hydro project. The incident was reminiscent of the 2013 disaster in Uttarakhand which killed thousands.

Why is Uttarakhand vulnerable?

Uttarakhand is located in the midst of young and unstable mountains, and is subject to intense rainfall. But these natural characteristics can't be solely responsible for devastations the State has winessed in the past decade. For years geologists, glaciologists and climate experts have voiced their fears about an impending disaster due to climate change, rapid and indiscriminate construction activities, and the subsequent ecological destruction in the region.

The agonising cost of ham-handed development
The occurrence of the current glacier burst was loosely attributed to erosion, a build-up of water pressure, an avalanche of snow or rocks, landslides or an earthquake under the ice. According to the Wadia Institute of Himalayan Geology, a rock mass, weakened from years of freezing and thawing of snow, may have led to the creation of a weak zone and fractures leading to a collapse that resulted in flash floods. What has intrigued experts and the local community is that this avalanche occurred unexpectedly, out of the regular flood season. Experts also identified large-scale human settlements and expansion of agricultural activities and the local community is that this avalanche occurred unexpectedly, out of the regular flood season. Experts also identified large-scale human settlements and expansion of agricultural activities of the propose of the

The need of the hour is to invest in long-term crisis response mechanisms and resilience solutions

especially in flood prevention and rapid response; (ii) climate proofing the infrastructure such as by applying road stabilisation technologies for fragile road networks and strengthening existing structures like bridges, culverts and tunnels; (iii) strengthening embankments with adequate scientific know-how; (iv) reassessing development of hydropower and other public infrastructure; (v) investing in a robust monitoring and early warning system; (vi) establishing implementable policies and regulatory guidelines to restrict detrimental human activities, including responsible eco-



exacerbating floods, provided hard evidence on he haphazard construction of dams was causing irreversib

A rescue operation near Raini village was halted due to surge in water levels of the Rishiganga on Thursday. Scientist warns of water build-up near Uttarakhand disaster zone

Some immediate steps

The need of the hour is to invest in long-term crisis response mechanisms and resilience solutions. A few immediate steps include: (i) investing in resilience planning,

and religious tourism policies; and (vii) investing in training and capacity building to educate and empower local communities to prevent and manage risks effectively.

effectively.

Rescue operations under way at Tapovan Tunnel. Two power projects — NTPC's Tapovan-Vishnugad hydel project and the Rishi Ganga Hydel Project — were extensively damaged. The time for wake-up calls is long behind us. India needs to urgently rise up to the challenge by applying innovative and inclusive solutions that support nature and marginalised communifies, to restore and rebuild a resilient future for Uttarakhand.

Effective regulation is key to banking reforms

Risis the season for banking reforms. Finance minister (FM) Nirmala Sitharaman's that corporate/industrial sannouncements on the policy for privatisation in banking, insurance and financial services indicate that there will be bare minimum presence of public sector enterprises. The privatisation of a general insurance company and two State-owned banks are to be taken up? in the year 2021-22. The FM has also proposed to set up an asset reconstruction and management company. While the are to set up an asset the construction and management company. While the are to set up an asset reconstruction and management company. While the are being the service seriler thought to be non-commitment. Indeed, the desire to change matters earlier thought to be non-negotiable seems to extend beyond the finance ministry. An internal working group of standard-setting, overance involves elements hegotiable seems to extend framework. Regulatory beyond the finance ministry. Governance involves elements An internal working group of standard-setting,

supervision and monitoring, and enforcement. Legislating standards requires a delicate balance between issuing rules to help industry understand the regulatory expectation clearly, and providing discretion to the regulator to reel in roque players who discretion to the regulator to reel in rogue players who abuse the rules. For instance, the simple principle that banks should not unfairly lend to people related to its owners, when translated into legal rules, will require a definition of the term "related". The owners/promoters of the bank would, of course, be covered and, if they are individuals, their immediate relatives. But what about lending to a cousin? Similarly, if the promoter is a company, a promoter is a company, a subsidiary and holding company would be covered.

INTERNATIONAL HOUSING FINANCE CORPORATION LIMITED
CIN: L65910GJ1990PLC014436
Regd. Office: "Moorti Bunglows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h.
Sundervan, Satellite, Ahmedabad - 380015.
Ph: 079-65214174 / 64502351 Email id: hicl@hotmail.com Website: www.ihfcl.com

STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2020 (RS. IN LAKHS)

Particulars	Quarter ended	9 Months Ended	Quarter Ended on
	31.12.2020	on 31.12.2020	31.12.2019
	Un-audited	Un-audited	Un-audited
Total income from operation (Net)			
Net Profit/(Loss) for the period (before Tax,	-0.12	-1.18	-0.1
Exceptional and / or Extraordinary Items)			
Net Profit/(Loss) for the period before Tax (after	-0.12	-1.18	-0.1
exceptional and / or Extraordinary Items)			
Net Profit/(Loss) for the period after Tax (after	-0.12	-1.18	-0.1
exceptional and / or Extraordinary Items)			
Total Comprehensive Income for the period			
(Comprising Profit/(Loss) for the period (after tax)			
and Other Comprehensive Income (after tax)			
Equity Share Capital	1632.75	1632.75	1632.75
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing			
and discontinued operations)			
Basic:	0.00	-0.01	0.00
Diluted:	0.00	-0.01	0.00

0.00	-0.01
-0.00	-0.01
-0.00	-0.01
-0.00	-0.01
-0.00	-0.01
-0.00	-0.01
-0.00	-0.01
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00	-0.00
-0.00 e www.ihfcl.com.	
For INTERNATIONAL HOUSING FINANCE CORPORATION LTD.

SD/-SANDIP B. PADSALA MANAGING DIRECTOR (DIN: 01870595)

B. NANJI ENTERPRISES LIMITED

CIN: L45201GJ1982PLC005148

Regd. Office: "Moorti Bunglows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h.
Sundervan, Satellie, Ahmedabad-380015.

Ph: 079- 65214174 / 64502351 Email id:bnanji@hotmail.com Website: www.bnanji.com

STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON31st DECEMBER, 2020 (BS IN LAKES)

Particulars	Quarter ended	9 Months Ended	Quarter Ended on
	31.12.2020	on 31.12.2020	31.12.2019
	Un-audited	Un-audited	Un-audited
Total income from operation (Net)	27.82	126.26	397.79
Net Profit/(Loss) for the period (before Tax,	-6.89	4.64	80.37
Exceptional and / or Extraordinary Items)			
Net Profit/(Loss) for the period before Tax (after	-6.89	4.64	80.37
exceptional and / or Extraordinary Items)			
Net Profit/(Loss) for the period after Tax (after	-6.89	4.64	80.37
exceptional and / or Extraordinary Items)			
Total Comprehensive Income for the period			
(Comprising Profit/(Loss) for the period (after tax)			
and Other Comprehensive Income (after tax)			
Equity Share Capital	551.45	551.45	551.45
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing			
and discontinued operations)			
Basic:	-0.12	0.08	1.46
Diluted:	-0.12	0.08	1.46

DUIUTEG:

Note: -The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter Financial Results are available on the stock exchange website at www.wbseindia.com/mand on company website at <a href="https://www.wbseindia.com/mand on the stock exchange website at <a href="https://www.wbseindia.com/www.wbseindia.com/mand on the stock exchange website at <a href="https://www.wbseindia.com/wwww.wbseindia.com/www.wbseindia.com/www.wbseindia.com/www.wbseindia.com/www.wbsei

For B. NANJI ENTERPRISES LIMITED

SD/-SANDIP B. PADSALA WHOLE TIME DIRECTOR (DIN: 01870595)

સંપાદકીય

કેવો છે ચીન-ભારત વચ્ચેનો ડિસએન્ગેજમેન્ટ પ્લાન?

એલએસી પર પૂર્વ લદાખથી ચીની સેના પીછેહઠ કરવા લાગી છે. ભારત બને ચીન વચ્ચે ડિસએંગેજમેન્ટની આખી પ્રક્રિયામાં ૧૦ થી ૧૫ દિવસ લાગવાના છે. આ દરમ્યાન ચીન કોઈ ચાલાકી ન દેખાય તેના માટે ભારતીય સેનાની નજર ચીનના આ ડિસર્એગેજમેન્ટ પ્રક્રિયા પર લાગી છે. અત્યાર સુધં થયેલા ડિસએંગેજમેન્ટને રિવ્યૂ કરવા માટે બંને દેશોની સેનાના સિનિય કમાન્ડરે મિટીંગ કરી. હાલમાં બેને દેશ લદાખના તમામ મોરસામાંથી પેંગોંગ સરોવર વિસ્તારમાં ત્રિસંગેંગ્જર્મન્ટ માટે રાજી થયા છે. પીપલ્સ લિબરેશ પ આર્મીની ટુકીઓ હવે કિંગરન્ટ થી પાછળ હરો એને કિંગર-તરી પા પાછળ જશે. છેલ્લા દસ મહિનામાં ચીને કિંગર-૪ સુધી જે મોરચાબંધી કરી છે પાછળ જશે. છલ્લા દસ માહનામાં ચાન દંગરે-- જે યુધા જ મારચાબાયાં કરો છ તે તમામ દૂર કરવામાં આવશે. ત્યાં જ ભારત પોતાની ઓફિલ્યન્ય પોરસ્ થાનસિંહ થાપા પર મોજુદ રહેશે. તે પોસ્ટ ફિંગર-- 3ની આસપાસ છે, જ્યાં ઇન્ડો-તિએટ બોર્ડર પોલીસના જવાનો મોજુદ છે. ત્રિસ્ત્રેગેજ્કમેન્ટ બાદ બંને દંશોની સેનાઓ પોતપોતાની પોલિસ્ત પર જશે અને એપ્રિલ ૨૦૨૦ના સ્ટેટર્સન મેન્ટેન કરવામાં આવશે. અત્યાર સુધી જે પણ ચીની માળુ ધું ફિંગર-૪ થી ફિંગર-૮ સુધી બનાવાયું હશે તેને તોડવામાં આવશે. પછી પીએલએ પોતાની પોઝિશન પર પાછી ચાલી જશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અનુસાન અસ્થાયી ૩૫ે નો-પેટોલિંગ ઝોન બની જશે. જ્યાં સધી બંને પક્ષ પેટોલિંગ જન્સના રૂપ તે ''જૂપાય' અંગ જેમ રહ્યું, હતા હુવા જેમ પ્રત્યુધી પર ન બહાલ કરવા સૈન્ય અને રાજદ્વારી ચર્ચાના માધ્યથી એક સમજૂતી પર ન પહોંચી જાય. મે ૨૦૨૦ના ગતિરોધ બાદ પેંગોંગ સરોવરના ઉત્તર દિક્ષણ તટ બે સૌથી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ ક્ષેત્રો બની ગયા હતા. ગતિરોધ પહેલાં થયેલ અથડામણોએ સરોવરની આસપાસના ક્ષેત્રોને સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ બનાવી દીધા છે. જોકે ઓગસ્ટમાં ભારતના જાંબાઝ સૈનિકોએ પોતાની વીરતાથી ચીની સૈનિકોના મનસૂબા ધ્વસ્ત કરી દીધા હતા અને પેંગોંગ સરોવરના દિક્ષણ કિનારે ઊંચાઈવાળા વિસ્તારો પણ પોતાન નિયંત્રણમાં લઈ લીધા હતા. ભારતીય સૈનિકોએ મગર હિલ, મુખપરી, ગુરાંગ અને રેજાંગલા અને રેચિનલાની પહાડીઓ સર કરી લીધી હતી. જેથી ઉત્તરી તટ પર ચીની પોઝિશન પર નજર રાખી શકાય. સપ્ટેમ્બર બાદથી ચીને ભાર દઈને કહ્યું હતું કે ભારત પહેલાં પોતાનું લશ્કર હટાવે, પરંતુ ભારતે મક્કમતાથી કહ્યું કે ડિસએંગેજમેન્ટ પ્રક્રિયામાં આખા ક્ષેત્રને સામેલ કરવું જોઇએ અને કહ્યું કે ડિસએંગેજમેન્ટ પ્રાક્રયામાં આખા જતા તા ત્યા કરે. સૈનિકોએ પોતાના એન્લિ ૨૦૨૦ની પોઝિશન પર પાછું જવું જોઇએ. હવે ત્યાં કરોતા સામેલા શ્રેલમાં ડિસએંગેજમેન્ટ માટે એવું લાગે છે કે બંને પક્ષો પહેલાં પેંગોંગ સરોવર ક્ષેત્રમાં ડિસએંગેજમેન્ટ માટે સહમત થઈ ગયા છે. જોકે ગતિરોધ હલ થઈ ગયો છે એવું માનવાની જરૂર નથી. હજુ પણ લદાખમાં ડેપસાંગ, ગોગરા પોસ્ટ, ગલવાન થાટી મુદ્દે તણાવ ચાલુ છે. પરંતુ હાલમાં જે કંઈ સહમતિ સધાઈ છે તે જોતાં આગળની -ક્રિયામાં પણ ચીન ગંભીરતાપૂર્વક સકારાત્મક રહેશે એવું લાગી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ફેલાવતા હોવાથી રજૂઆત

સીસ્ટમ હાઈવે ઉપર લગાવવાની માંગ

કરી હતી. આ ઉપરાંત દિવસ તેમજ રાત્રીના જીઈબી, યુજીવીસીએલના પાવર

રેઈટમાં મોટા ઉદ્યોગોને જે લાભો

આપવામાં આવે છે તેના કારણે રાત્રીન

સમયે મોટાપાયે હવાનું -દુષણ થાય છે

આ અંગે અનેક વખતે જીપીસીબી

ગ્રામ્યમાં રજુઆત કરી હોવા છતાં કોઈપણ જાતનો યોગ્ય જવાબ મળતો નથી આથી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા પશુપક્ષીઓ

તેમજ માનવજીવનને મોટાપાયે હવાનું -દુષણ સહન કરવાનો વારો આવી રક્ષો છે

આથી અમદાવાદ જીલ્લા ઔદ્યોગિક

વિસ્તારના હાઈવે ઉપર એર મોનીટર સીસ્ટમ લગાવવામાં આવે તેવી બાવળાના સામાજીક કાર્યકર –કુલભાઈ મહેતાએ

.... ૦૧૦ના નક્કા સમય પર ચૂકવણી સુનિશ્ચિત કરવાની જોગવાઇ છે.

Date:13/02/2021 Place:Ahmedabad

અમદાવાદ જેલ્લાના નેશનલ પાસેથી ચોવીસ કલાક હવીનું દ્રુપણ હાઈલે સહિત મુખ્ય માર્ગો પર અનેક માપવાની સીસ્ટમ લગાવીને તેની ખાનગી ઓશીઈએ એમાં ઓવલા છે કાર્બનાઇટીકાઈડ, ઓક્સીજન માટે જેમાં અમુક એકમો દ્વારા મોટાપાયે જાહેર કરાવવા તેમજ એરમોનીટરીંગ હવાનં -દૂષણ કરવામાં આવી રક્ષાં છે હવાનું વુસ્ત કરવામાં ગાવા હતું છ ત્યારે આ વિસ્તારની હવાનું ન્દુપણ માપવાની સીસ્ટમ લગાવવામાં આવે તેવી બાવળાના સામાજીક કાર્યકરે જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ જબ અમદાવાદ જીલ્લામાં અાઈડીસીએ તેમજ ખાનગી ઔદ્યોગિક એકમો મોટીસંખ્યામાં વર્ષોથી ધમધમી રજ્ઞાં છે અને અંદાજે ૪૦૦૦થી વધ કંપનીઓ આવેલી છે ત્યારે જલ્લાના નાના-નાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે કંપનીઓ દ્વારા હવાનું -દુષણ ફેલાવામાં આવી રક્ષું છે. જેમાં સનાથલથી બગોદરા તેમજ શાંતીપુરાથી વિરમગામ સુધીમાં હવા -દુષણના નિયંત્રણ માટે ગુજરાત -દુષણ જીલ્લા કલેક્ટરનેલેખીત રજુઆત કરી હતી.

કૃષિ કાયદાઓના વિરોધ માટે કુતર્ક મોદી સરકારના નવા કૃષિ ખેડૂતોને સ્થાનિક એપીએમેસી કે તેથી ર્જાતિ સ્વાનક અવાબનસા કે તેવા ઇતર વિકલ્પ પસંદ કરવાની આઝાદી છે, ત્યાં જ વેપારીઓ માટે પણ ખેડૂતોને તેમની ઉપજની નક્કી સમય પર

મોદી સરકારના નવા કૃષિ કાયદાઓ પર વિરોધ આંદોલન ચાલુ છે. આ ત્રણેય કાયદાઓના સમર્ છે. આ પ્રકામ કામકાંગામાં સંપદ્ધ આકલનથી એ જ સાર નીકળશે કે તેમનો વિરોધ તાર્કિક આધારે નહીં પણ રાજકીય સંકીર્ણતાને કારણે કરાઈ રક્ષો છે. આ કાયદાઓનો હેતુ ખેડૂતોને સશક્ત કરીને તેમને બજાર સાથે જોડવાનો છે. આ -ક્રિયામાં એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ટેકાના ભાવ અને મંડી સમિતિઓ પર પણ કોઈ આંચ ન આવે. તેમાં પહેલો કાયદો ખેડત ઉપજ વેપાર અને વાશિજય (સંવર્ધન અને સુવિધા) અધિનિયમ ૨૦૨૦ છે. તે ખેડતોને પોતાના ક્ષેત્રમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીથી ઇતર પોતાની ઉપજ વેચવાની આઝાદી આપે છે. તેની ધારા ૩ ખેડતોને પોતાના રાજ્ય કે રાજ્યની સીમાની બહાર ઉપજને લઈ જવાની સ્વતંત્રતા આપે છે. એક અન્ય ધારા અનસાર ખેડતોની સાથે લેણદેણ કરનારા વેપારીએ એ જ દિવસે કે અધિકતમ ત્રણ કાર્ય દિવસોમાં ખેડૂતને કોઇપણ ભોગે ચૂકવણી કરવાની રહેશે. આ કાયદો કેન્દ્ર સરકારને સમયબઢ વિવાદ નિકાલ માટે કૃષે ઉપજ મૂલ્ય સૂચના અને બજાર આસ્ચના (ઈન્ટેલીજન્સ) તંત્ર વિકસિત કરવાની ગુંજાશ આપે છે. આ કાયદામાં જ્યાં

Printed & Published by Mayur C. Bhal on behalf of Kalyani Pub. Pvt. Ltd Printed at- Mahadev Offset, H-47 Ra Estate, Rustam Mill Compound, Dudheshwar, Ahmedbada-4. Publishe from 201-2, Nandan Com. Opp. Mithakhali Rly Crossing, Mithakhali, Ahd-6 Edi.: Mayur Bhatt

જિસે ખુદ સે બઢ કર ચાહો વો રૂલાતા જરૂર હે... બે દિવસ પછી એક એવો દિવસ નીકળી પડશે. કેટલાક અતિ સંસ્કારી તત્ત્વની ઉપાસનાનો અને તેની લાગે એગે એટેતભાવ ન્ગટે ત્યારે જ આવશે જેની ઉપર અઢળક લખાશે. સજ્જનો અને સમારીઓ આ દિવસની હિવ્યતાનો સાશાત્કાર છે. 'મનું મૃલ્ય દિવ્ય'-મનો સાશાત્કાર થતો હોય છે. ૧૪મી કેબ્રુઆરીની રાહ કાગડોળે યુવા ઉજવણીના વિરોધ કરવા રેલીનું ઘણી વખત છૂટી ગયા પછી જ સમજાતું સ્વતેનો હોમ થાય, 'હું' નો લોપ થાય

હૈયાઓ જોતા હોય છે. એ દિવર અગાઉના વિવિધ દિવસોની ઉજવણી થવા જ લાગી છે. ચોકલેટ ડે, ટેડી બેર કે અને ન જાણ્યા હોય એવા દિવસો ધૂમધામથી ઉજવાઈ રક્ષાાં છે. ભારતીય સંસ્કૃતિમાં આવા કોઈ ચોક્કસ દિવસ ઉજવવાની પરંપરા નથી એટલે કે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા જ નથી. આપણે ત્યાં તો આખી વસંતઋતુ ેમની ઋત માનવામાં આવે છે જ - મના જાહુ ાચીન સાહિત્યમાં વસંત્રજીતુના શૃંગારપૂર્ણ વર્શનો વાંચીએ તો પડે કે નચીન ભારત કેટલું એડવાન્સ અત્યારે આવા ઉછીના અને હોં. અત્યાર આવા ઉછાના અન છીછરા દિવસો ઉજવતા આપણા યુવાધનને કોણ સમજાવે કે કાલીદાસના નાટકો વાંચો, શુદ્રકનું મૃચ્છકટિકમ વાંચો વેલેન્ટાઈન ડેની ઉજવણીનો ભ્રમ ભાંગી જશે એટલું શૃંગારીક આપશું નચીન ભારત હતું. કમનસીબે આ બધા ગ્રંથો સંસ્કૃતમાં લખાયા છે અને સંસ્કૃત તો દેવભાષા છે. એટલે દેવો જ વાંચે ને! ખેર ! સંસ્કૃત ભાષાનો મહિમા નથી

કરવો પરંતુ એ જ ખબર નથી પડતી કે જાણે -ેમની અનુભૂતિ અને અભિવ્યક્તિ કરવાનો વરસમાં એક જ દિવસ એટલે ૧૪મી ફેબ્રુઆરી હોય તેમ તમામ લાલ-પીળા ફૂલો લઈને લાગતા વળગતાને આપવા તત્પર બની જશે કેટલાકને કોઈ ન મળ્યું હોય તો ખુદ જ લાલ પીળા બની આવા દિવસોની ઉજવણી ભારતીય સંસ્કૃતિનું હનન કરનારી છે કહીને નારા લગાવતા

એટલે રાજકીય પક્ષો મતદારોની તાસીર

ઓળખી જાય છે. મતદારોને રીઝવવા

રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર રસોડા શરૂ

કરી દેવામાં આવે છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજકોટમાં મનપાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા

માટે રાજકીય પક્ષોએ ઠેર ઠેર રસોડા

શરૂ કરી દીધા છે. ઝશ્ર્સ્ક્કિંગ્રિસ્તિથએ શહેરમાં વોર્ડ નં.૧૮માં ચાલતા રસોડા

પર પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.

જેમાં જોવા મળ્યું હતું કે ભાજપ ભજિયાં, કોંગ્રેસ ચાપડી-શાકઅને આપ

ગાંઠિયા-છાશનો જમણવાર કરી રજ્ઞા

છે. રાજકીય પક્ષોના જમણવારમાં

સોસાયટીઓમાં લોકોએ સાંજના રસોડા

કોના બાપની દિવાળી જેવાં દશ્યો જોવા મળ્યાં હતાં. લોકો ભજિયાં, ગાંઠિયા,

ચાપડી-શાકની જિયાકત ઉડાવવા માટે

પડાપડી કરતા નજરે પડ્યા હતા. લોકો રસ્તા પર બેસી જમી રજ્ઞા હતા.

રાજકોટમાં વિધાનસભા, લોકસભા કે

પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે

એટલે લોકોનો સાંજના જમણવારનો

ખર્ચ બચી જાય છે. રાજકીય પક્ષોના

જમણવારમાં પહોંચી જાય અને પેટ

ભરાન ભાજન આરાગ છ. લોકોએ જણાવ્યું હતું કે આજે કોંગ્રેસનું ચાપડી-શાક આરોગ્યું અને કાલે ભાજપનાં ભજિયાની મજા માણીશું, જોકેમત કોને આપીશું એ અંગે

રાજકીય પક્ષોના આ જમણવારમાં

બંધ કરી દીધાનું જાણવા મળ્યું હતું.

આયોજન કરી સંસ્કૃતિને બચાવવા પણ -યત્નશીલ થશે પરંતુ આવા સંસ્કારી માતા-પિતાના હોનહાર સંસ્કૃતિ પૂજક સંતાનો વેલન્ટાઈન ડે ધામધુમથી ઉજવતા હોય છે !! સંસ્કૃતિનું કરવા આપણા દેશમાં અનેક સેનાઓ અને દળ કાર્યરત છે. ગુલાબની આપ-લે કરતા યુવાનોને મેથીપાકનો -સાદ ચાપી શકાય તેવા ઉમદા આશયથી આવી સેના કે દળના ઉત્સાહી કાર્યકરો ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રસ્તા પર બેરોકટોક ફરી ધોલધપાટની -વૃત્તિઓ પણ કરશે. ઘણીવાર તો બીચાર્ય ગુલાબના ફૂલની પણ દયા આવે. ગુલાબનો શું વાંક ? એનું કામ તો જેના હાથમાં જાય એને સુગંધ જ આપવાનું છે વેલેન્ટાઈન ડે ઉજવવો કે નહીં ? એ દર વર્ષે વિવાદાસ્પદ મુદ્દો બને છે. અત્યારના અતિ ઝડપથી બંધાતા અને તેનાથી વધુ ઝડપથી તુટતા સંબંધોના યુગમાં આ વર્ષે જેને વેલેન્ટાઈન કહીને કૂલ આપ્યા હોય એ આવતી ૧૪મી

રેજુ અંધર ધુરાના ગટલાઇ ગયા હાય એવું બહુધા બનતું હોય છે!! -મ વિશે લખવું બહુ સરળ છે. પરંતુ એને નિભાવવો એટલો જ અઘરો છે. ેમ, લાગણી, હૂંક, સ્રેહ, વ્હાલ આ બધા શબ્દો સરહદ વગરના શબ્દો છે. કોની હદ ક્યાંથી શરૂ થાય છે એ જ કહેવં હું કે ક્યારા સરૂ યાત્ર છે જ ૪ કહ્યું મુશ્કેલ છે. પાણી વહેતું થાય પછી નક્કી નથી હોતું કે તે ઝરણું બનશે કે નદી, એવી જ આ વાત છે. -ેમની ઓળખ કરવી કંઈ સહેલી નથી એ તો પરમ

જલસા કરતા જોવા મળ્યા હતા.

કોરોના ગાઇડલાઇન્સનો ઉલાળ્યો

રાજકીય પક્ષોના જમણવારમાં કોરોનાની ગાઇડલાઇન્સનો ઉલાળ્યો

જોવા મળ્યો હતો. લોકોએ દો ગજ કી

દૂરી ભૂલી માત્ર જમણવારમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોય એવાં દશ્યો જોવા

મળ્યાં હતાં. જમણવારમાં નાનાં

બાળકોથી માંડી વૃદ્ધ લોકો પણ જોવા મળ્યાં હતાં. જમણવારની લાલચ આપી

આટલી ભીડ એકત્રિત કરી રાજકીય

પક્ષો કોરોનાને આમંત્રણ આપી રજ્ઞા હોય એવી ચર્ચા ઊઠી હતી.

જમણવારમાં મોટા ભાગના લોકો માસ્ક

ઉમેદવારના કાર્યાલયમાં ચા પાણીની કીટલી ફરતી રહે છે

ઉમેદવારના કાર્યાલય પર ચા-હમદવારના કાવાલય પર ચા-પાણીની કીટલી ફરતી રહે છે. રોજ સેંકડો કપ ચા પીવાય છે. કોઈપણ મહત્ત્વની વ્યક્તિ કે કાર્યકર દેખાય કે

તરત ચાની કીટલી હાજર થઇ જાય છે. સાંજ ઢળ્યે નાસ્તાની પ્લેટ પણ આવી

જાય છે. રાજકોટમાં ચૂંટણી લડી રહેલાઓના કાર્યાલયમાં દરરોજ રાતે વાનગીઓની મહેફિલો શરૂ થઈ ગઈ

છે. તાવા પાર્ટીઓનું પણ જોરદાર આકર્ષણ કાર્યકરોને રહે છે. રાજકોટના

ભદ્ર વિસ્તારોની ૧૦૦થી ૨૦૦

પરિવારોના રહેણાક ધરાવતી

વગર જ જોવા મળ્યા હતા.

રાજકીય પક્ષોના જમણવારમાં

રાજકોટસૌરાષ્ટ્રમાં ચૂંટણી આવે પૂછતાં લોકોએ મૌન સેવી લીધું હતું. ટ્લે રાજકીય પક્ષો મતદારોની તાસીર હાલ તો લોકો મત ક્યાપક્ષને આપશે ળખી જાય છે. મતદારોને રીઝવવા એનું વિચાર્યા વગર જમણવારમાં

આપનાં ગાંઠિયા-છાશ, સોસાયટીઓમાં સાંજે લોકોના રસોડા બંધ

ર્ફેબ્રુઆરી સુધીમાં બદલાઈ ગયા હોય

હોય છે. બિનશરતી -ેમ ભાગ્યે જ કોઈને હાય છે. જિમસારતા "ન ખાંગ્ય જ કાઇમ મળતો હોય છે, પણ તેની કિંમત ક્ચારેય સામેવાળી વ્યક્તિ કરી શકતી નથી. બિનશરતી -ેમ કરનારા લોકોની કદર

ાળપતારતા "ન કરવારા લાકાવા કદર તેમના ગયા પછી જ થતી હોય છે. ેમ એટલે શું ? એ -'નો જવાબ -'મ એટલે શું નહી ?' એ શોધતા જ મળે તેમ છે. -ેમમાં પઝેશન અને પોઝિશન બંને અંતરાયરૂપ બને છે -ેમ લખવાનો, વાંચવાનો કે કોઈ એક વ્યક્તિના અધિકારનો વિષય જ નથી. બંધાતો દરેક સંબંધ ઋણાનુબંધની કુંડળી જ હોય છે. ેમનું પાંગરવું એ કોઈ એક દિવસની ઘટના નથી જેમ બીજ વાવ્યા પછી વક્ષ બનતા વાર લાગે છે તેમ -ેમને પણ પાંગરતા વાર લાગે છે.

પાંગરતા વાર લાગે છે. ેમમાં દ્વૈતભાવ નહીં અદ્ભૈતભાવ સધાવો જોઈએ. ેમમાં એકમેકના અલગ-અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર્ થવો જોઈએ. દ્વૈતનો સ્વીકાર જ અદ્ભૈતને શક્ય બનાવ છે. ટહુકે ટહૂકે ઓગળવાનું નામ એટલે -ેમ ઓંગળેએ જ ભળીંશકે અને ભળી શકે તે જ વહી શકે. અસ્તિત્વને વહી જવા દેવામાં -સન્નતાનો અનુભવ થઈ શકે તેવી સમજણ એ જ મીરાંબાઈનો ેમ આવી ઊંચાઈએ પહોંચ્યો હતો. મીરાંબાઈએ લખ્યું છે કે 'રાધા તારા ડુંગરીયે બોલે ઝીણા મોર' -ેમની ઊંચાઈએ પહોંચ્યા પછી જ આવી અભિવ્યક્તિ થતી હોય છે. રાધા કૃષ્ણ-િયા છે. અને મીરાં કૃષ્ણ દિવાની છે. પોતાની -ેમીની -ેમિકા પણ પોતાની

ડિપ્લોમસીઓ શરૂ થઈ છે.

...... ઉમેદવારના કોઈ ટેકેદાર આવીને

પાર્ટીનું નક્કી કરી જાય અને રાત પડે કે તરત કેટરિંગ સર્વિસવાળા આવીને ફટાફ્ટ વાનગીઓ બનાવી નાખે છે.

જમણવાર શરૂ થાય કે થોડીવારમાં

ઉમેદવાર -ચાર માટે આવી જાય અને થોડી ભાષણબાજી પછી કાર્યક્રમ

પૂરો થઈ જાય છે. ડિનર પાર્ટીમાં પરંપરાગત દેશી વાનગીઓ ઉપરાંત

ચાઈનીઝ કે પંજાબી આઈટેમો પણ

ડિમાંડમાં રહે છે. હાલ -થમ તબક્કે

માત્ર મુખ્ય કાર્યાલય પર તાવડા મંડાયેલા રહે છે, પણ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય તેમ

જેટલા કાર્યાલય ખૂલે ત્યાં તાવડા મંડાય છે. રાતે ખાણી-પીણી ચૂંટણી

માંગ છે. રાત ખાલા પાલા યુદ્રશા કાર્યાલય પર આમ વાત રહે છે. ચૂંટશી લડી રહેલા ઉમેદવારોની ભજિયાં કે ગાંઠિયા પાર્ટીઓ ઉપરાંત વરાળીયું કે ઘૂંટો જેવી પરંપરાગત ગ્રામીણ વાનગીઓ વાડીઓમાં બને

છે અને જૂથ સભાઓ થઈ જાય છે

તાવો પણ ફેવરિટ વાનગી છે.

બટાકાપૌવા, ચિપ્સ જેવી વાનગીઓ પણ બને છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર રસોડા

શરૂ કરી દેવામાં આવે છે. હાલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે.

રાજકોટમાં મનપાની ચંટણીમાં

ડિમાંડમાં રહે છે

સોસાયટીઓમાં પણ સિસ્ટમેટિક હિનર મતદારોને રીઝવવા માટે રાજકીય

વાનસાઓ સરૂવે છે છે. પૈયાએ ટર ટર રસાડા સરૂ કરા દાપા ચાઇનીઝ કે પંજાબી આઈટેમો પણ છે. ઝ્રક્ઝ ક્કિંગ્રિસ્તિથએ શહેરમાં વોર્ડ

ત્યારે જ અદ્રૈતના યશનો અગ્નિ -ગટે

-ેમનું બીજુ નામ જ સમર્પણ છે. મ કદી ભેટ-સોંગાદોથી ખરીદાતો નથી અને ભેટ-સોગાદોથી ખરીદાય એ કદી -ેમ હોતો જ નથી સાચા -ેમની વેલ ઉપર હંમેશા વેદનાના ફલો ખીલે છે અને આ વેલ હંમેશા આંખોના મોતી એવા આંસુઓથી સીંચાતી હોય છે. મીરાંબાઈએ અહૂત પંક્તિઓ કહી છે કે 'અસુવન જલ સીંચ-સીંચ -ેમ બેલી બોઈ'મનના મંદિરમાં ધૂપ બનીને મહેંકતો ેમ બહુ ઓછાના નસીબમાં હોય છે. કોઈના માટે ખાલી થઈ જવાની. ઠલવાઈ જવાની, ફના થઈ જવાની લાગણી એ જ -ેમ છે. કંઈ નથી હોતું છતાં પણ કંઈક હોય છે. કેટલાક સંબંધો બધી જ વ્યાખ્યાઓથી પર હોય છે. જરૂરી નથી કે આપણે જેને ઝંખતા હોઈએ એ આપશી સાથે જ હોય. આપશી પાસે જ હોય. મેં શબ્દ તુમ અર્થ, તુમ બીન મેં વ્યર્થ જેવી અનુભૂતિ સર્જાય ત્યારે -ેમ દૈહિક મટી આધ્યાત્મિક બનતો હોય છે સંબંધો એજ શાશ્વત હોય છે. જેમાં આપવાનું જ હોય કંઈ લેવાનું ન હોય એક વાતની હંમેશા કાળજી રાખજો તમારી સાચા દિલથી સંભાળ રાખનારાઓની ક્ચારેય અવગણના ન કરશો. કોઈ હાથને એટલો પણ દૂર ન થવા દેતા કે તેને પાછી પકડી જ ન શકાય કદી સંબંધોમાં પાનખર ન આવવા દેત કેમ કે વિશ્વાસના વૃક્ષો ફરી લીલાછમ નથી જ બનતા. મતદારોને રીઝવવા -પ્રયાસ, ભાજપનાં ભજિયાં, કોંગ્રેસનું ચાપડી-શાક,

પક્ષોએ ઠેર ઠેર રસોડા શરૂ કરી દીધા

નં.૧૮માં ચાલતા રસોડા પર પહોંચી

ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં જોવા

કોરોના પેટે પ૬૮ કરોડ ખર્ચ કરાયા સરકારે અમદાવાદ મ્યુનિ.ને આપ્યા ૨૧૪ કરોડ

અમદાવાદ ૨૧ ફેબુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૮ વોર્ડની ૧૯૧ બેઠકો માટે મતદાન યોજાવાનું છે.આ મતદાન અગાઉ છે.ગત માર્ચથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીમાં દર્દીઓ ની સારવારથી લઈને હોસ્પિટલોના બિલોની ચૂકવણી સહિત જેવા ખર્ચ પેટે અત્યાર સુધીમાં કુલ રુપિયા પદ્દ૮ કરોડની રકમનો ખર્ચ કર્યો છે.જેની સામે રાજય સરકારે માત્ર ૨૧૪ કરોડ રુપિયા ગ્રાન્ટ પેટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યા છે.છેલ્લા છ મહિનાથી રાજય સરકાર તરફથી અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનને નવી કોઈ રકમ ગ્રાન્ટ પેટે આપવામાં ના આવી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના

મ્યુાનાસપલ કાપારશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહીતી મુજબ,માર્ચ-૨૦૧૯માં અમદાવાદ ખર્ચ કરશે એ રકમ તેને રકમ જ આપવામાં આવી છે.

રકમ જ આપવામાં આવા છે. અમદાવાદ મ્યુ નિસિપલ કોર્પોરેશનને દર વર્ષે મુખ્યમંત્રી સ્વર્શિમ જયંતીની ગ્રાન્ટ પેટે કુલ રુપિયા ૬પ૦ કરોડ જેટલી રકમ ગ્રાન્ટ પેટે આપવામાં આવતી હોય છે.આ ગ્રાન્ટની રકમની સામે જુન-૨૦૨૦ સુધીમાં સરકાર

તરફથી કુલ ટૃપિયા ૪૫૦ કરોડ આપવામાં આવ્યા હતા.આ રકમ પણ કોરોનાની સારવાર પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવી છે.ખાટલે મોટી ખોટ તો એ રહી કે,રાજય સરકાર દ્વારા આત્મ નિર્ભર યોજના હેઠળ -ોપર્ટીટેકસ ભરનારાને ખાસ વીસ ટકા વળત આપવાની જાહેરાત કરી હતી.એ રકમનું વળતર મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર તરફથી મળવાનું હતું.વીસ ટકા લેખે એ વળતરની ૨કમ ૮૫ કરોડ જેટલી થાય છે એ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર તરફથી આપવામાં આવી ના હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગત જુન-૨૦૨૦માં અનલોક-વનના આરંભ સમયે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણાં બધા વિકાસ કામો ઉપર બ્રેક લગાવી દેવામાં આવી હોવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.હાલની પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટરોના બિલો સહિતના અન્ય બિલોની ચૂકવણી પેટે સાહારાના અન્ય ખિલાના યૂઝવજા પટ કુલ રુપિયા ૨૫૫ કરોડનું ચૂકવણું કરવાનું છે. ટેક્સની આવકમાં પણ ઘટાડો થવા પામ્યો હોવાથી આર્થિક તરલતાના અભાવે આ તમામ બિલોન પેમેન્ટના કરી શકાયા હોવાનુ પમન્ટના કરા શકાયા હાવાનુ સત્તાવારસુગોએ કહ્યું છે. આ મતદાન અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો રેશનનું અર્થતંગ આર્થિક લ્લિસમાં મુકાઈ ગયું છે. ગત માર્યથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હ્વારા કોરોના મહામારીમાં દર્દીઓની સારવારથી લઈને હોસ્પિટલોના બિલોની ચૂકવણી સહિત જેવા ખર્ચ . પેટે અત્યાર સુધીમાં કુલ રુપિયા પદ્દ*ે* કરોડની રકમનો ખર્ચ કર્યો છે.જેની સામે રાજય સરકારે માત્ર ૨૧૪ કરોડ સાય સાથ સારકાર યાત્ર રાજ કરાડ રુપિયા ગ્રાન્ટ પેટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યા છે.છેલ્લા છ મહિનાથી રાજય સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવી કોઈ રકમ ગ્રાન્ટ પેટે આપવામાં ના આવી હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશનન સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે

શહેરમાં કોરોના મહામારીની શરૃઆત થઈ હતી.એ સમયે રાજય સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે,મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના ગુરું, પાછળ જે ખર્ચ કરશે એ રકમ તેને ગ્રાન્ટ પેટે રાજય સરકાર પરત કરશે.સરકાર તરફથી મળેલા આ આશાસન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓ માટેની કીટ હોય હેન્ડરલોજ હોય દવાઓ અથવા તો ઈન્જેકશન હોય કે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની હોય અથવા તો ફૂડ પેકેટ પહોંચાડવાના હોય આ સહિતની પણ અન્ય આવશ્યક બાબતો માટે થઈને કુલ મળીને પદ્દ૮ કરોડ જેટલી જંગી રકમનું ખર્ચ કર્યું છે.આ ખર્ચની સામે સરકાર તરફથી મ્યુનિસિપલ તંત્રને હજુ સુધી માત્ર રુપિયા ૨૧૪ કરોડની

મળ્યું હતું કે ભાજપ ભજિયાં, કોંગ્રેસ ચાપડી-શાક અને આપ ગાંઢિયા-છાશનો જમણવાર કરી રજ્ઞા છે.

INTERNATIONAL HOUSING FINANCE CORPORATION LIMITED CIN: L659106J1990PLC014436

Regd. Office: "Moortl Bunglows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad-380015. Sundervan, Satellite, Ahmedabad- 380015.

Ph: 079- 65214174 / 64502351 Email id: ihfcl@hotmail.com Website: www.ihfcl.com

STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2020 (RS. IN LAKHS)

Particulars	Quarter ended 31.12.2020	9 Months Ended on 31.12.2020	Quarter Ended on 31.12.2019
	Un-audited	Un-audited	Un-audited
Total income from operation (Net)			
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	-0.12	-1.18	-0.1
Net Profit/(Loss) for the period before Tax (after exceptional and / or Extraordinary Items)	-0.12	-1.18	-0.1
Net Profit/(Loss) for the period after Tax (after exceptional and / or Extraordinary Items)	-0.12	-1.18	-0.1
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)			
Equity Share Capital	1632.75	1632.75	1632.75
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
Basic:	0.00	-0.01	0.00
Diluted:	0.00	-0.01	0.00
Note: - The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges			

e www.ihfcl.com.
For INTERNATIONAL HOUSING FINANCE CORPORATION LTD.

SANDIP B. PADSALA MANAGING DIRECTOR (DIN: 01870595)

GLOBE TEXTILES (INDIA) LIMITED

(CIN: L65910GJ1995PLC027673)

(Regd. Office:Plot No. 38 to 41, Ahmedabad Apparel Park, GiDC Khokhra, Ahmedabad, Gujarat - 380008)

E-mail id: cs@globetextiles.net | website: www.globetextiles.net Contact No: 0091-79-22931881 to 1885

nancial Results for the Quarter ended 31st December,
(Rs. In Lakhs) Except EPS and

	Quarte	Nine Month Ended	
Particulars	31-12-2020	31-12-2019	31-12-2020
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total income from operations (net)	9832.31	7524.80	18279.90
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	176.35	(84.48)	(53.25)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	176.35	(84.48)	(53.25)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	176.35	(84.48)	(53.25)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	175.70	(85.53)	(55.19)
Equity Share Capital	1007.61	1007.61	1007.61
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)			
Earnings Per Share (of`Rs.10/- each)(for continuing and discontinued operations)			
Basic:	1.74	(0.85)	(0.55)
Diluted:	1.74	(0.85)	(0.55)

ote: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing bilgations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the the website of the Company www.globtectilise.engl and on the website of SEE Lid (invern.seindia.com). The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed y means of a footnotie.

te.

Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

For, GLOBETEXTILES (INDIA) LIMITED

Bhavik Suryakant Pariki (Managing Director) (DIN: 00038223)

B. NANJI ENTERPRISES LIMITED

CIN: L45201GJ1982PLC005148

Regd. Office: "Moorti Bunglows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h.
Sundervan, Satellite, Ahmedabad. 380015.

Ph: 079-65214174 / 64502351 Email id:bnanji@hotmail.com Website: www.bnanji.com

STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON31*DECEMBER, 2020 (BS. IN LAKHS)

Particulars	Quarter ended	9 Months Ended	Quarter Ended on
	31.12.2020	on 31.12.2020	31.12.2019
	Un-audited	Un-audited	Un-audited
Total income from operation (Net)	27.82	126.26	397.79
Net Profit/(Loss) for the period (before Tax,	-6.89	4.64	80.37
Exceptional and / or Extraordinary Items)			
Net Profit/(Loss) for the period before Tax (after	-6.89	4.64	80.37
exceptional and / or Extraordinary Items)			
Net Profit/(Loss) for the period after Tax (after	-6.89	4.64	80.37
exceptional and / or Extraordinary Items)			
Total Comprehensive Income for the period			
(Comprising Profit/(Loss) for the period (after tax)			
and Other Comprehensive Income (after tax)			
Equity Share Capital	551.45	551.45	551.45
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing			
and discontinued operations)			
Basic:	-0.12	0.08	1.46
Diluted:	-0.12	0.08	1.46
Note: - The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges			

33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full forma ancial Results are available on the stock exchange website at www.bscindia.com.and on company

For B. NANJI ENTERPRISES LIMITED SD/-SANDIP B. PADSALA

WHOLE TIME DIRECTOR (DIN: 01870595) Date: 12/02/2021